

સિક્ચોરિટાઈજેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાઈનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ગેરેશન્ટ ઓફ સિક્ચોરિટી ઈન્ટેરેસ્ટ એક્ટ-2002 ના નિયમ 6 (2) અને 8 (6) હેઠળ સ્થાવર મિલકતોના વેચાણ માટેની ઈ-ઓક્શન વેચાણ સૂચના.

જાહેરમાં સામાન્ય રીતે અને ખાસ કરીને લેનારા (ઓ), મોર્ગેજર (ઓ) અને ગેરંટર (ઓ) ને સૂચના આપવામાં આવી છે કે નીચે વર્ણવેલ સ્થાવર મિલકત મોર્ટેગેજ/ચાર્જ સુરક્ષિત સદ્ધર લેણદારને ચાર્જ આપવામાં આવે છે. જેનો કબજો બેન્ક ઓફ બરોડાના અધિકૃત અધિકારી, સિક્ચોરિટી કંટ્રોલર દ્વારા લેવામાં આવ્યો છે. નીચે જણાવેલ ખાતા / ખાતામાં બાકી લેણાંની વસૂલાત માટે “જેમ છે તેમ”, “જે છે તે”, અને “જે કંઈ છે ત્યાં” વેચવામાં આવશે. લેનારા/મોર્ગેજર/ગેરંટર સુરક્ષિત સંપત્તિ, બાકી લેણાંની રકમ, અનામત ભાવ, ઈ-દરારાજીની તારીખ અને સમય, ઇએમડી અને બિડ વધારો રકમની વિગતો નીચે જણાવેલ છે.

ઈ-દરારાજી માટે તારીખ / સમય : તા.૨૫.૦૯.૨૦૨૬ સમય : બપોરે ૨.૦૦ સે ૬.૦૦ કલાકે (દરેક ૧૦ મિનિટ અમર્યાદિત એક્સ્ટેન્શન સાથે)

ક્રમ નં.	શાખાનું નામ અને ઉધારકર્તા નું નામ	મિલકત નો પ્રકાર અને વિવરણ	કલમ ૧૩(૨) હેઠળ કિંમત નોટિસ ની તારીખ અને બાકી હેલ્થું રૂ.	અનામત કિંમત (RV) રૂ. તથા ઇએમડી (EMD) રૂ.	પરેશનન ની સ્થિતિ	સંપર્ક અધિકારી અને સંપર્ક નં.
૧.	લાંબવેલ બ્રાન્ચ ૧) શ્રી હરેશકુમાર ચંદુલાલ ભટ્ટ અને શ્રીમતી પન્નાબેન હરેશકુમાર ભટ્ટ ૨) શ્રી હરેશકુમાર ચંદુલાલ ભટ્ટ	રહેણાંક સબ પ્લોટ નં. ૧૦/એ, ૪૧.૬૫ ચોરસ મીટર વિસ્તાર, અવિભાજિત રોડ અને કોમન પ્લોટ વિસ્તાર સાથે ૪૧.૬૭૫ ચો.મી. એટલે કે કુલ ૮૩.૩૨૫ ચો.મી, જે બિન-ખેતી જમીન પર સ્થિત છે, જે આર.એસ.નં. ૮ કુલ માપ હે. ૦-૨૪-૯૭ છે. ગામ જોળ, તા. જિ. આણંદની સીમાઓ નીચે મુજબ છે. વર્ણન: પૂર્વ તરફ: સોસાયટી એપ્રોચ રોડ, પશ્ચિમ તરફ: સર્વેનં. ૭, ઉત્તર તરફ: સબ પ્લોટ નં. ૧૦, દક્ષિણ તરફ: સબ પ્લોટ નં. ૧૦/બી. તેની સાથે હાલમાં અસ્તિત્વમાં રહેલ તેમજ ભવિષ્યમાં બાંધવામાં આવનાર તમામ ઈમારતો, બાંધકામ, શેડ, ઓફિસ વગેરે તથા પૃથ્વી સાથે જોડાયેલ કોઈપણ વસ્તુ સ્થાયી રીતે સંલગ્ન કરવામાં આવેલ તમામ હાલની તેમજ ભાવિ સ્થાવર મિલકતો સહિત.	તા. ૧૬.૦૯.૨૦૨૫ રૂ. ૯,૧૨,૪૩૨.૧૪ (બાકી પડતું વ્યાજ તથા વધારાના ખર્ચાઓ)	અનામત કિંમત રૂ. ૧૫,૫૭,૦૦૦/- (રૂપિયા પંદર લાખ સત્તાવન હજાર પુરા) ઇએમડી રૂ. ૧,૫૫,૭૦૦/- (રૂપિયા એક લાખ પંચાવન હજાર સાતસો પુરા) (બીજો પ્રયત્ન)	સાંકેતિક (Symbolic)	શ્રી પવનકુમાર પાંડે મો. ૯૬૮૭૬૭૨૮૫૨

અનામત કિંમત સાથેની મિલકત માટે લઘુત્તમ વધારાનું રકમ રૂ. ૧૦,૦૦૦/-
મિલકત ના નિરીક્ષણ માટે તારીખ : ૨૩.૦૯.૨૦૨૬ અને સમય : સવારે ૧૦:૦૦ થી બપોરે ૦૪:૦૦ સુધી.
 (ઉપર જણાવ્યા મુજબ EMD રકમ બીડર ગ્લોબલ ઇમેડી વાલેટ માંથી (<https://www.baanknet.com>) ચાલન પેઢી પછી NEFT દ્વારા ઓનલાઇન ચૂકવવામાં આવશે)
 વેચાણની વિગતવાર નિયમો અને શરતો માટે, કૃપા કરીને આપેલી લિંકનો સંદર્ભ લો. <https://www.bankofbaroda.in/e-auction.htm> તથા <https://baanknet.in> સાથી, સંબંધિત બોલી લગાવનારા(ઓ) ઉપર જણાવ્યા અધિકારીનો મો. નં. ૯૬૮૭૬૭૨૮૫૨ **લાંબવેલ બ્રાન્ચ**, બેંક ઓફ બરોડા, વસૂલી વિભાગ, સેન્ટ્રીય કચેરાલય, આણંદ માં સંપર્ક કરી શકે છે.



સરકેસી એક્ટ અંતર્ગત લોન લેનાર / જામીનદાર / મોર્ગેજર ને -૧૫-દિવસ ની વૈધાનિક નોટીસ

ઉપરોક્ત લોન લેનાર/જામીનદાર/મોર્ગેજર ને આ સાથે જણાવવામાં આવે છે કે સરકેસી એક્ટ અંતર્ગત આપેલ નોટિસ ૧૩(૨) પ્રમાણે કુલ લેણા ની બાકી રકમ હરાજી ની તારીખ પહેલા ભરી દેવી. જો તેમ કરવામાં કસૂર થશે તો સદર મિલકત હરાજી દ્વારા વેચાણ કરવામાં આવશે અને ત્યારબાદ બાકી રહેલી લેણાની રકમ વ્યાજ અને અન્ય ખર્ચા સહિત લોન લેનાર/જામીનદાર પાસે થી વસૂલ કરવામાં આવશે.

તારીખ : ૦૮.૦૯.૨૦૨૬
સ્થળ : આણંદ

સહી/-
અધિકૃત અધિકારી,
બેંક ઓફ બરોડા

- ઓનલાઇન ઇ-હરાજી હરાજી પોર્ટલ વેબસાઇટ દ્વારા એટલે કે <https://baanknet.in> ઉપર જણાવેલ તારીખ અને સમય પર કરવામાં આવશે. જેમાં ૧૦ મિનિટના અમર્યાદિત વિસ્તરણ સાથે કરવામાં આવશે. ઇચ્છુક બોલી લગાવનારાઓ/ખરીદદારોએ તેમના મોબાઇલ નંબર અને માન્ય ઇમેઇલ-આડીનો ઉપયોગ કરીને (ખરીદનારની નોંધણી-વેબસાઇટના હોમ પેજ પર પુરી પાડવામાં આવેલી લિંક) મારફતે નોંધણી કરાવવી જરૂરી છે. ઇચ્છુક બિડર્સ/ખરીદદારોએ કેવાયસી દસ્તાવેજો અને બેંક વિગતો અપલોડ કરવાની જરૂર છે. ઇચ્છુક બિડર્સ/ખરીદદારોને હરાજી પોર્ટલ વેબસાઇટના હોમ પેજ પર પૂરા પાડવામાં આવેલા બાયર મેન્યુઅલ દ્વારા માર્ગદર્શન આપી શકાય છે.
- કેવાયસી વેરિફિકેશન-રજીસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ ઇચ્છુક બિડર્સ/ખરીદનારાઓએ કેવાયસી ડોક્યુમેન્ટ્સ અને બેંક એકાઉન્ટ ડિટેલ અપલોડ કરવાની રહેશે નોંધણી અને અપલોડ કરવાની ઔપચારિકતાઓ અગાઉથી પૂર્ણ કરવામાં આવશે.
- ઇએમડી ચુકવણી-કેવાસી ચકાસણી પૂર્ણ થયા પછી, ઇચ્છુક બિડરો/ખરીદદારો લોગિન કરીને ઇએમડી ચુકવણી કરી શકે છે, ઇએમડી ચુકવણીનો ઇરાદો ધરાવતા ખરીદદારોને ખરીદદાર તરીકે લોગિન કર્યા પછી તેમાં પૂરા પાડવામાં આવેલા બાયર મેન્યુઅલ દ્વારા માર્ગદર્શન આપી શકાય છે. ચુકવણી ગેટવે દ્વારા અને ચલણો બનાવીને અને વોલેટમાં રકમ જમા કરીને પણ કરી શકાય છે. ચુકવણી નિર્ધારિત સમય પહેલાં અગાઉથી સારી રીતે સુનિશ્ચિત કરવામાં આવશે. જો જરૂરી ઇએમડી રકમ ખરીદનાર વોલેટમાં રાખવામાં નહીં આવે તો તેમને ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. રસ ધરાવતી બિડર-ઇ-હરાજી બંધ થાય તે પહેલાં <https://baanknet.in> હરાજી પોર્ટલ પાસે ગ્રી-બિડ ઇએમડી જમા કરાવી શકે છે.
જમા કરાવવામાં આવેલા અનરેસ્ટ મનીમાં કોઇ વ્યાજ રહેશે નહીં. અસફળ બિડરોના ઇએમડીના રિફંડ માટે બિડરે <https://baanknet.in> લોગ ઇન કરીને ઇ-હરાજી સર્વિસ પ્રોવાઇડર પાસેથી ઓનલાઇન રિફંડ મેળવવાનું રહેશે અને બાયર મેન્યુઅલમાં આપવામાં આવેલા રિફંડ માટેની પ્રક્રિયાને અનુસરીને અને ઓનલાઇન રિફંડ માગ્યા બાદ જ રિફંડ ઇ-ઓર્કેસ્ટ્રેશન સર્વિસ પ્રોવ દ્વારા રિફંડ મેળવવામાં આવશે. અસફળ બોલી લગાવનારાઓની ઇફેમી રકમ વ્યાજ વગર પરત કરવામાં આવશે.
- બોલી લગાવતી વખતે બોલી લગાવનારે તે મિલકતની પસંદગી કરવાની હોય છે, જેના માટે ઉપરોક્ત વેબસાઇટમાં ઉલ્લેખિત યાદીમાંથી ઓફર સબમિટ કરવામાં આવી હોય અને/અથવા બોલી લગાવનાર સીધા જ પ્રોપર્ટી આઇડી દાખલ કરી શકે છે.
હેલ્પ ડેસ્ક
- પ્રશ્નો પૂછવા માટે સંપર્ક નંબર : ૮૨૮૧૨૨૦૨૨૦ અને ઇમેઇલ આઇડી support.baanknet@psballiance.com
- રજીસ્ટ્રેશન અને લોગિન અને બિડિંગ નિયમો માટે <https://baanknet.in> હોમ પેજમાં પૂરી પાડવામાં આવેલી બાયર મેન્યુઅલ લિંકની મુલાકાત લે છે.
- હરાજીમાં પોપર્ટીને લગતા પ્રશ્નો માટે, બિડર્સ છેલ્લા પેરામાં આપવામાં આવેલી સંપર્ક વિગતો પર બેંક અધિકારીઓનો સંપર્ક કરી શકે છે.
- ટીઇપીએસ સામેલ છે.
- મોબાઇલ નંબર અને ઇમેઇલ આઇડીનો ઉપયોગ કરીને <https://baanknet.in> પર નોંધણી કરાવો.
- જરૂરી કેવાયસી દસ્તાવેજો અપલોડ કરો.
- ઇએમડીની રકમ પેમેન્ટ ગેટવે દ્વારા અને ચલણ જનરેટ કરીને અને બિડરના ઇએમડી વોલેટમાં ઇએમડીની રકમ ટ્રાન્સફર કરીને પણ ચૂકવો.
- હરાજી તારીખ અને સમય પર બિડ સબમિટ કરવાની પ્રક્રિયા ઓનલાઇન માધ્યમથી કરવામાં આવશે.
- સફળ બિડના કિસ્સામાં, બાકીની બોલીની રકમ અહીં જણાવેલ શરતો અનુસાર ચૂકવવાની રહેશે.
- સુપરત કરવાની બીડ કિંમત રીઝર્વ કિંમતને સમતુલ્ય અથવા તેનાથી વધુ હોવી જોઈએ અને ઇ-હરાજી દરમિયાન બીડરોને ઇન્ટર-સે બીડિંગમાં તેમની બીડ વધારવાની પરવાનગી આપવામાં આવશે અને છેલ્લા બોલાયેલ બીડથી વધુ અને ઉપર ટેબલમાં આપેલ બીડની રકમમાં ઓછામાં ઓછા વધારામાં બીડરોની છેલ્લી સૌથી ઊંચી બીડ બોલવાની રહેશે. મિલકત અધિકૃત અધિકારી દ્વારા નિયત કરાયેલ રીઝર્વ કિંમતથી ઓછી કિંમતે વેચવામાં આવશે નહીં. રીઝર્વ કિંમતથી ઓછી બોલાયેલ બીડ રદ કરવામાં આવશે. બીડર જાહેર વેચાણ નોટીસ/વેચાણની શરતો અને નિયમોમાં જણાવેલ રકમના ગુણાંકમાં તેમની બીડમાં વધારો કરી શકશે. છેલ્લી દશ મિનિટમાં બીડ મળવાનાં કિસ્સામાં ૧૦ મિનિટનું અમર્યાદિત લંબાણ કરવામાં આવશે. સફળ ઊંચી બીડ બોલવા માટે બીડરોને ૧૦ મિનિટનો સમય આપવામાં આવશે ને દશ મિનિટ પૂર્ણ થયા પછી છેલ્લી ઉંચી બીડ ઓફર નહીં કરે તો ઇ-હરાજી અટકાવવામાં આવશે.
- ઇચ્છુક બીડરોને વેચાણ નોટીસ, ઇ-હરાજીની શરતો અને નિયમો, ઇ-હરાજીની પ્રક્રિયા અંગેનું હેલ્પ મેન્યુઅલ ધ્યાનથી વાંચવા અને તેનું કડકપણે પાલન કરવા સલાહ આપવામાં આવે છે.
- જો બોલીદારો પ્રતીકાત્મક કબજાવાળી મિલકતો માટે બોલી લગાવી રહ્યો હોય, તો બેંકની વર્તમાન માર્ગદર્શિકા મુજબ નીચે મુજબના નિયમો અને શરતો લાગુ પડશે. જેનો સારાંશ નીચે આપેલ છે.
 - મિલકત પ્રતીકાત્મક કબજામાં છે અને બોલીદાર પોતાની જાતના જોખમ અને જવાબદારી પર પ્રતીકાત્મક કબજાવાળી મિલકત ખરીદી રહ્યો છે.
 - બેંક માત્ર પ્રતીકાત્મક રીતે જ મિલકતનો કબજો સોંપશે અને સફળ હરાજી બોલીદાર/ખરીદદાર બેંક પાસેથી ભૌતિક કબજાની માંગણી કરશે નહીં.
 - ભૌતિક કબજો સોંપવા માટે બેંક જવાબદાર અથવા બાધ્ય રહેશે નહીં.
 - સફળ હરાજી ખરીદદારને, પૈસા પરત કરવાની કોઇપણ પરિસ્થિતિમાં, કોઇ વ્યાજનો દાવો કરવાનો અધિકાર રહેશે નહીં.
 - સફળ હરાજી ખરીદદારે ઇ-હરાજી બાદ તરત જ ઉપરોક્ત નિયમો અને શરતોની પુષ્ટિ કરતું ડિક્લેરેશન કમ અન્ડરટેકિંગ સબમિટ કરવું પડશે.
 - વેચાણ બાદ જો સફળ બોલીદાર ડિક્લેરેશન કમ અન્ડરટેકિંગ સબમિટ કરવામાં નિષ્ફળ જાય, તો બોલીની ઇએમડી રકમ જમ કરવામાં આવશે. (જે માટે દરેક બોલીદાર ઇ-હરાજીમાં ભાગ લેવા માટે BAANKNET પોર્ટલ પર નિયમો અને શરતો સ્વીકારતી વખતે પોતાની સંમતિ આપેલ માનવામાં આવશે.
- અધિકૃત અધિકારી દ્વારા ઇ-હરાજી પૂર્ણ થયા પછી, ફક્ત સફળ બીડરોને (સર્વિસ પ્રદાતા પાસે રજીસ્ટર્ડ /તેમના દ્વારા અપાયેલ મોબાઇલ/નંબર /ઇમેઇલ ઓફિસ પર) એસએમએસ/ઇમેઇલ મારફત અમારા ઉપરોક્ત સર્વિસ પ્રદાતા દ્વારા જાણ કરવામાં આવશે.
- સફળ હરાજી ખરીદદાર/બીડરે બીડની રકમના ૨૫ ટકા (પચ્ચીસ ટકા) (એટલે કે પહેલા જમા કરેલ ઇએમડીની રકમ સહીત) હરાજીની સમાપ્તિ/અંતના રોજ તે જ દિવસે અથવા તે પછીના ચાલુ કામકાજના દિવસે તાત્કાલિક જમા કરવાની રહેશે. સફળ હરાજી ખરીદદાર /બીડરે અધિકૃત અધિકારીને ચુકવવાપાત્ર બાકીની બીડ ખરીદીની રકમ મિલકતના વેચાણની મંજૂરીની તારીખથી પંદર દિવસે અથવા તે પહેલા અથવા ખરીદદાર અને સિક્ચોરિટી લેણદાર વચ્ચે લેખિતમાં મંજૂર કરાયેલ આવા વિસ્તારેલ સમયગાળા દરમિયાન ચુકવવાની રહેશે, પરંતુ કોઇપણ સંજોગોમાં ૩ માસ કરતાં વધુ નહીં. જણાવેલ સમયની અંદર ઉપર જણાવ્યા મુજબની રકમ જમા કરવામાં નિષ્ફળતાના કિસ્સામાં, સફળ બીડર દ્વારા જમા કરાયેલ રકમ બેંક અને અધિકૃત અધિકારી દ્વારા જમ કરવામાં આવશે અને અધિકૃત અધિકારી મિલકતની નવી હરાજી/વેચાણ કરવા સ્વતંત્ર રહેશે અને કસુરવાર બીડર જમ કરાયેલ રકમ અને મિલકત પર કોઇ દાવો ધરાવશે નહીં.
- ચુકવણીમાં કસુર:ઉપર જણાવ્યા મુજબ તે જ દિવસે અથવા પછીના ચાલુ દિવસે ૨૫ ટકા બીડની રકમ (ઇએમડી બાદ કરીને)ની ચુકવણીમાં અને/અથવા જણાવેલ સમયમાં બીડની બાકી ૭૫ ટકા રકમની ચુકવણીમાં કસુર થશે તો કોઇપણ નોટીસ વગર વેચાણ આપમેળે રદ થશે. સફળ બીડર દ્વારા ચુકવાયેલ ઇએમડી અને અન્ય નાણાં બેંકના અધિકૃત અધિકારી દ્વારા જમ કરવામાં આવશે.
- બેંકને સફળ બીડર દ્વારા વેચાણની કિંમતની ચુકવણી ઇન્કમ ટેક્સ એક્ટ, ૧૯૬૧ની કલમ ૧૯૪ આઇએ હેઠળ ટીડીએસને આધિન રહેશે અને ટીડીએસ સફળ બીડરે બીડની બાકીની ૭૫ ટકા રકમ જમા કરતી વખતે ભરવાનો રહેશે. સફળ હરાજી ખરીદદાર/બીડરે બીડની રકમ પર લાગુ જીએસટી બેંકને ચુકવવાનો રહેશે.
- વેચાણની સંપૂર્ણ કિંમત મળ્યા પછી અધિકૃત અધિકારી નિયમો મુજબ વેચાણ પ્રમાણપત્ર જારી કરશે. ખરીદદારે સ્ટેમ્પ ડ્યુટી, તેમજ વેચાણના પ્રમાણપત્રનો રજીસ્ટ્રેશન ચાર્જ, મિલકતોને લગતા હાલના કે ભવિષ્યના સરકારી/કોઇપણ પ્રાધિકરણને ચુકવવાપાત્ર તમામ કાનુની બાકી લેણાં, વેરા, જીએસટી, દરો અને ખર્ચ ભોગવવાના રહેશે.
- વેચાણ સર્ટીફિકેટમાં બીડમાં જણાવ્યા સિવાય કોઇપણ નામનો સમાવેશ/બદલીની કોઇપણ દરખાસ્ત સ્વીકારવામાં આવશે નહીં. વેચાણ સર્ટીફિકેટ માત્ર સફળ બીડરના નામે જારી કરવામાં આવશે.
- વેચાણ સર્ટીફિકેટ જારી કરવા સામે ડીઆરટી/ડીઆરએટી/હાઇકોર્ટ અથવા કોઇપણ અન્ય કોર્ટ દ્વારા પસાર કરાયેલ કોઇપણ રોકાણ/મનાઈ હુકમ/પ્રતિબંધિત આદેશની પડતર કાર્યવાહીમાં વેચાણ સર્ટીફિકેટ જારી કરવામાં આવશે નહીં. આ ગાળા દરમિયાન જમા કરેલ રકમ પર વ્યાજ આપવામાં આવશે નહીં. સફળ બીડર દ્વારા કરાયેલ જમા રકમ, વેચાણ સર્ટીફિકેટનો પડતર અમલ, ડીપોઝીટ એકાઉન્ટમાં વ્યાજ વગર રાખવામાં આવશે. વેચાણના અંશતઃ અથવા સંપૂર્ણ રદ બંનેમાં જમા પરત મેળવવાની દરખાસ્ત સ્વીકારવામાં આવશે નહીં. ડીઆરટી/ડીઆરએટી/હાઇકોર્ટ અથવા કોઇ અન્ય કોર્ટ દ્વારા પ્રક્રિયાને આગળ વધારવા પર રોકના કિસ્સામાં હરાજીને વિલંબિત અથવા રદ કરવામાં આવશે અને વેચાણમાં ભાગ લેનાર વ્યક્તિઓને આવી મોકુફી કે રદ માટે નુકશાન, વળતર અથવા ખર્ચ માટે અધિકૃત અધિકારી /બેંક સામે દાવો કરવાનો હક મળશે નહીં.
- અધિકૃત અધિકારી /બેંક કોઇપણ આગોતરી નોટીસ વગર અને કોઇપણ કારણ જણાવ્યા વગર કોઇપણ બીડનો સ્વીકાર અને અસ્વીકાર અથવા વેચાણ મોકુફ/મુલતવી / રદ રાખવાનો અને વેચાણની શરતો અને નિયમોમાં ફેરપાટ કરવાનો તેમજ જો જુના બીડર નિષ્ફળ જાય તો બીજી સૌથી ઉંચી બીડ બોલનારને બોલવાનો હક અનામત રાખે છે.
- ઇચ્છુક ખરીદદાર તે /તેણીના ખર્ચે ઉપર જણાવેલ તારીખ અને સમયે મિલકતનું નિરિક્ષણ કરી શકે છે. બેંકમાં ઉપલબ્ધ ટાઇટલ દસ્તાવેજો અને અન્ય દસ્તાવેજોના નિરિક્ષણ માટે, ઇચ્છુક બીડરો હરાજીની તારીખથી બે દિવસ પહેલા ઓફિસ કલાકો દરમિયાન બેંક ઓફ બરોડા, ઝેડઓએસએઆર બ્રાંચનો સંપર્ક કરી શકે છે.
- મિલકત જ્યાં છે, જે છે, જેમ છે કોઇપણ આશ્રય આધાર વિનાના ધોરણે વેચવામાં આવી રહી છે અને ઇચ્છુક બીડરોએ ઓનલાઇન બીડ સુપરત કરતા પહેલાં તેમની વિવેકબુદ્ધિથી સ્વતંત્ર પુછપરછ કરવી જોઈએ અને લાગતા વળગતા રજીસ્ટ્રાર/એસઆરઓ/રેવન્યૂ રેકોર્ડ/અન્ય કાનુની પ્રાધિકરણોના બોજો અને બેંકના ચાર્જ સિવાય કોઇપણ અન્ય પ્રાધિકરણ જેવા કે વેચાણ વેરા, એક્સાઇઝ/જીએસટી/આવકવેરના કોઇપણ દાવા/હક્કો/બાકી રકમ ચાર્જ અંગે ચકાસણી કરવી જોઈએ અને ટાઇટલ, પ્રકાર, વર્ણન, વિસ્તાર, ગુણવત્તા, પ્રમાણ સ્થિતિ, બોજો, પુર્વાધિકાર, ચાર્જ, કાનુની બાકી રકમ વગેરેના સંબંધમાં સંતોષકારક ખાતરી કરવી જોઈએ.ઇ-હરાજીની જાહેરાત બેંકના કોઇ નિવેદન અથવા કોઇપણ રજુઆત પુરતની કે ગણવામાં આવશે નહીં. અધિકૃત અધિકારી-સિક્ચોરિટી કંટ્રોલર કોઇપણ ત્રાહીત વ્યક્તિના દાવા/હક્કો/બાકી રકમ માટે કોઇપણ રીતે જવાબદાર ગણાશે નહીં.
- બેંક વેચાણ માટે મુકાયેલ મિલકતના સંબંધમાં કોઇપણ મંજૂરી-લાયસન્સ, એનઓસી વગેરેની પ્રક્રિયા માટે અથવા પાણી/સેવા ચાર્જ, ટ્રાન્સફર ફી, ઇલેક્ટ્રીસીટીની બાકી રકમ, મ્યુનિસિપલ કોર્પોરેશન/સ્થાનિક પ્રાધિકરણ/કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીની બાકી રકમ, અથવા અન્ય કોઇ બાકી રકમ, વેરા, પુર્વાધિકાર, ફી, જણાવેલ મિલકતના વેચાણને સંબંધિત અને /અથવા ને લગતી ટ્રાન્સફર ફી ની કોઇપણ જવાબદારી લેશે નહીં. સફળ બીડરે મિલકતની ખરીદીને લગતી ઇન્કમેટેક્ષની જોગવાઈઓનું પાલન કરવું અને લાગુ દરો મુજબ પ્રાધિકરણોને વેરો ચુકવવો પડશે.
- અધિકૃત અધિકારી કોઇપણ પ્રસંગોપાત અને વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને જરૂર જણાયતો કોઇપણ શરતમાં સુધારો/ફેરફાર/રદ કરવા સ્વતંત્ર છે. બેંક/અધિકૃત અધિકારી કોઇપણ આગાતરી નોટીસ વગર અને કોઇપણ કારણ જણાવ્યા વગર કોઇપણ બીડરનો સ્વીકાર કે અસ્વીકાર કરવા અને વેચાણની કોઇપણ શરતો અને નિયમોમાં ફેરફાર કરવા વેચાણ મોકુફ/મુલતવી/રદ કરવાનો અબાધિક હક ધરાવે છે. બીડરોએ વેચાણની તમામ શરતો વાંચવી અને સમજવાની રહેશે અને તે બંધનકર્તા રહેશે. બીડરો અને /અથવા સફળ બીડર દ્વારા કોઇપણ કાઉન્ટર ઓફર/શરતો ઓફર/શરતોને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. અહીં ઉપર વર્ણાયેલ શબ્દો અને વાક્યો સરકેસી એક્ટ, ૨૦૦૨ એ તે હેઠળ રચાયેલ નિયમોમાં દર્શાવેલ અર્થાનુસાર છે.
- વેચાણ સિક્ચોરિટી કંટ્રોલર બેંકની મંજૂરીને આધિન છે.
- વેચાણ સરકેસીની એક્ટ ૨૦૦૨ અને તે હેઠળ ઘડાયેલ નિયમો હેઠળ જણાવેલ શરતો / નિયમો/જોગવાઈઓ અને ઉપર જણાવેલ શરતોને આધિન રહેશે. વેચાણની વિગતવાર શરતો અને નિયમો માટે ભાવી બીડરો અધિકૃત અધિકારી શ્રી પવનકુમાર પાંડે મો. : ૯૬૮૭૬૭૨૮૫૨ નો સંપર્ક પણ કરી શકે છે.

તારીખ :
સ્થળ : અધિકૃત અધિકારી,
બેંક ઓફ બરોડા

નોંધ: વિવાદની સ્થિતિમાં અંગ્રેજી આવૃત્તિમાં પ્રકાશિત થયેલ નોટીસ માન્ય ગણાશે.